



તમારા COVID-19 રસીકરણનો પૂરાવો મેળવો

તમારું **immunisation history statement** (આપવામાં આવેલ રસીઓની નોંધ દર્શાવતો અહેવાલ) તમારી **COVID-19** રસીકરણની સ્થિતિની નોંધ રાખે છે.

તમારો અહેવાલ મેળવવાની સૌથી સરળ રીત, નીચેના બંનેમાંથી કોઈ એકનો ઉપયોગ કરીને ઓનલાઇન મેળવવાની છે:

- myGov (માયગવ) મારફતે તમારા Medicare online (મેડીકેર ઓનલાઇન) ખાતામાંથી
- Express Plus Medicare (એક્સપ્રેસ પ્લસ મેડીકેર) મોબાઇલ એપ.

તમારું immunisation history statement કેવી રીતે મેળવવું

myGov મારફતે તમારા Medicare online ખાતાનો ઉપયોગ કરીને:

1. myGovમાં સાઇન ઇન કરો અને Medicare પર ક્લિક કરો.
2. **Immunisation history** (રસીકરણ ઇતિહાસ)ની તકતી પસંદ કરો, **View statement** (સ્ટેટમેન્ટ જોવું) પસંદ કરો.
3. તમારા નામ પર ક્લિક કરો અને પછી **View history statement (PDF)** પર ક્લિક કરો.

Express Plus Medicare મોબાઇલ એપનો ઉપયોગ કરીને:

1. એપમાં લોગ ઓન કરો.
2. **Services** (સેવાઓ)માંથી **Immunisation history** આંગળીથી અડો.
3. તમારું નામ પર આંગળી અરાડો અને પછી **View history statement (PDF)** પર અડો.

જો તમે તમારું immunisation history statement ઓનલાઇન ન મેળવી શકો અથવા મદદની જરૂર હોય તો, **1800 653 809** પર ફોન કરો.

જો તમારું Medicare ઓનલાઇન ખાતું ન હોય

Medicare ઓનલાઇન ખાતું ખોલવા તમારે તમારું Medicare તમારા myGov ખાતા સાથે જોડવું પડશે.

my.gov.au પર જઈને myGov ખાતામાં સાઇન ઇન કરો અથવા જો ન હોય તો તે બનાવો.

ત્યારબાદ તમે નીચેનામાંથી એક રીતે Medicareને જોડી શકો છો:

- તમારો Medicare કાર્ડ નંબર અને તમારી Medicareને લગતી બીજી માહિતી જેમકે ભૂતકાળમાં ક્યાં ઉપયોગ કર્યું છે
- Medicare દ્વારા જારી કરવામાં આવેલ જોડવાનો કોડ.

Medicareને myGov સાથે જોડવામાં મદદ માટે, servicesaustralia.gov.au/medicareguides પર જશો.

તમારી Medicareની સંપર્કની વિગતો અદ્યતન રાખો

તમારી Medicareની સંપર્કની વિગતો અદ્યતન હોય તે અગત્યનું છે. તમે Medicare ઓનલાઇન ખાતા અથવા Express Plus Medicare મોબાઇલ એપનો ઉપયોગ કરીને તમારી સંપર્કની વિગતો જોઇ અને તેમાં સુધારા-વધારા કરી શકો છો.

જો તમે Medicare અથવા Department of Veterans' Affairs (DVA) (લશ્કરમાંથી નિવૃત્ત થયેલાઓ માટેનું ખાતું - ડીવીએ) માટે પાત્ર ન હોવ

My Health Record દ્વારા રસીકરણ સારાંશ મેળવવા તમે અમારી પાસેથી Individual Healthcare Identifier (IHI) (વ્યક્તિગત હેલ્થકેર આઇડેન્ટિફાયર) માટે વિનંતી કરી શકો છો. વધુ માહિતી માટે servicesaustralia.gov.au/ihi પર જશો.

નવીનતમ COVID-19 વિગતો અને સલાહ માટે, australia.gov.au પર જશો.

વધુ માહિતી માટે

- અમારી સાથે Medicare સેવાઓની બાબતમાં તમારી ભાષામાં વાત કરવા Translating and Interpreting Service (TIS National) (અનુવાદ અને દુભાષિયા સેવા)ને **131 450** પર ફોન કરો.
- અંગ્રેજીમાં વધુ માહિતી માટે servicesaustralia.gov.au/ihs પર જશો.
- servicesaustralia.gov.au/yourlanguage પર જાઓ ત્યાં તમે તમારી ભાષામાં માહિતી વાંચી, સાંભળી અથવા વીડિઓ જોઇ શકો છો.
- સેવા કેન્દ્રની મુલાકાત લો.

નોંધ: ઓસ્ટ્રેલિયામાં ક્યાંયથી પણ તમારા ઘરના ફોનથી '૧૩' નંબર પરના કોલ પર નિશ્ચિત દર લાગુ પડે છે. તે દર સ્થાનિક કોલની કિંમતથી જુદો હોય શકે છે અને જુદા જુદા ટેલિફોન સેવા પ્રદાતાઓ વચ્ચે પણ જુદો હોય

શકે છે. તમારા ઘરના ફોનથી '૧૮૦૦' નંબરો પરના ફોન નિ:શુલ્ક છે. જાહેર અને મોબાઇલ ફોન દ્વારા થતા ફોન મર્યાદિત હોય શકે છે અને ઊંચા દર લાગુ પડી શકે છે.